

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ
બોર્ડ બેઠક નં.-૧૬૧, તા. ૦૫-૦૯-૨૦૨૦ના રોજ ૧૧-૦૦ કલાકે

અનુક્રમણિકા

મુદ્દા નં.	વિગત	ઠરાવ નંબર	પાના નંબર
૧	તા. ૦૪-૦૭-૨૦૨૦નાં રોજ યોજાયેલ બોર્ડ બેઠક નં.-૧૬૦મી બોર્ડ બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવા બાબત.	૧૮૪૮	૧
૨	તા.૦૪-૦૭-૨૦૨૦નાં રોજ યોજાયેલ સત્તામંડળની ૧૬૦મી બોર્ડ બેઠકની કાર્યવાહી નોંધમાં થયેલ ઠરાવોની અમલવારીની સમીક્ષા કરવા બાબત.	૧૮૪૯	૧
૩	મુસદ્દારૂપ નગર રચના યોજના નં.૩૮/૧ (માધાપર)ની સત્તામંડળ દ્વારા અધિનિયમ - ૧૯૭૬ તથા નિયમો - ૧૯૭૯ હેઠળ કાર્યવાહી કરી કલમ -૪૨(૧) હેઠળ રાજ્યપત્રમાં અને દૈનિક પત્રોમાં કરાયેલ પ્રસિધ્ધીની કાર્યવાહીને બહાલ રાખવા તથા અધિનિયમ - ૧૯૭૬ની કલમ - ૪૭ હેઠળ મળેલા વાંધા સૂચનો અને રજૂઆતો માટે નિર્ણય કરવા અને અધિનિયમ - ૧૯૭૬ની કલમ - ૪૮(૧) હેઠળ રાજ્ય સરકારશ્રીને મંજૂરી અર્થે સાદર કરવા બાબત.	૧૮૫૦	૨ થી ૩
૪.	રૂડા દ્વારા તૈયાર કરાયેલી રૂડા વિસ્તારની મંજૂર થયેલી ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં.૪૩ (વાજડી-વડ)ની પ્રારંભિક યોજનાની ટી.પી.ઓ દ્વારા તૈયાર કરાયેલ કામ ચલાઉ પુનઃરચનાની દરખાસ્તોને પરામર્શ આપવા બાબત.	૧૮૫૧	૪ થી ૫
૫.	સત્તામંડળનાં સમગ્ર શહેરીકરણ વિસ્તારમાં સૂચિત કરાયેલ નગર રચના યોજનાઓ (૭૬-પરાપીપળીયા, ૭૭-વાજડીગઢ, ૭૮-શાપર, ૭૯-વેરાવળ) બનાવવા બાબત.	૧૮૫૨	૬ થી ૭
૬.	રૂડા બોર્ડ બેઠક નં.૧૦૮ના ઠરાવ નં.૧૧૮૯ની જોગવાઈ મુજબ સોઇલ ટેસ્ટીંગ તથા મટીરીયલ્સ ટેસ્ટીંગ લેબોરેટરી અંગેની માન્યતા આપવા સબબની નિમાયેલ કમીટીના મેમ્બર્સમાં સુધારો થવા બાબત તથા સોઇલ ટેસ્ટીંગ તથા મટીરીયલ ટેસ્ટીંગ લેબોરેટરીની માન્યતા આપવા સબબની નિર્ધારિત થયેલ લાયકાત ઉપરાંત એન.એ.બી.એલ.નો ઉમેરો થવા બાબત.	૧૮૫૩	૮
૭.	રાજકોટ મહાનગરપાલિકા વિસ્તાર માટેના ડી.પી.પાર્ટ પ્લાન તથા ઓન સર્ટી, ઓન અભિપ્રાય વિગેરે જાહેર જનતાને આપવા અંગેની સત્તા રાજકોટ મહાનગરપાલિકાને આપવા બાબત.	૧૮૫૪	૯
૮.	સત્તામંડળમાં રજૂ થતા લે-આઉટ પ્લાન, બાંધકામ પ્લાન, સબ-પ્લોટીંગ પ્લાન તથા એમાલગમેશન પ્લાન વિગેરેમાં સરકારી/અર્ધસરકારી કચેરીના વાંધા પ્રમાણપત્ર ન મળતા ના-મંજૂર	૧૮૫૫	૧૦

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ

બોર્ડ બેઠક નં.-૧૬૧, તા. ૦૫-૦૯-૨૦૨૦ના રોજ ૧૧-૦૦ કલાકે

	થયેલ વિકાસ પરવાનગીના પ્રકરણો એક વર્ષ સુધીમાં પુનઃ રજુ થતા ચકાસણી ફી ન વસુલવા બાબત.		
૯.	સત્તામંડળની ૨૪ (ચોવીસ) ગામોની પાણી પુરવઠા યોજનાના પાર્ટ-૨ માં સમાવિષ્ટ થતા હેડવર્કસ બનાવવા માટે મુંજકા ગામે ટી.પી-૧૭ના ફા.પ્લોટ-૮૧ની ફાળવણી કરવા બાબત.	૧૮૫૬	૧૧
૧૦.	માઘાપર અને ઘંટેશ્વર ગામો રાજકોટ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થતા SJMMSVY ગ્રાંટ અંતર્ગત રૂડા દ્વારા આયોજીત ૨૪ ગામોની પાણી પુરવઠા યોજના પૈકી ફેરફારો થતા ૫(પાંચ) ગામો પરાપીપળીયા, ન્યારા, ખંઢેરી, બાઘી અને નારણકા ગામો માટે અલગથી પાઈપલાઈન તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિગેરેની કામગીરી કરવાની થતી હોય, મંજૂરી આપવા બાબત.	૧૮૫૭	૧૨ થી ૧૪
૧૧.	સત્તામંડળ વિસ્તારમાં રીંગરોડ-૨, ફેઝ-૨ની પથરેખામાં આવેલ ચે.૮૨૭૫ પરના બ્રીજમાં કરવાની થતી વધારાની કામગીરીને બહાલી આપવા બાબત.	૧૮૫૮	૧૫

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ
બોર્ડ બેઠક નં.-૧૬૧, તા. ૦૫-૦૯-૨૦૨૦ના રોજ ૧૧-૦૦ કલાકે

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની તા. ૦૫-૦૯-૨૦૨૦નાં રોજ યોજાયેલ એકસો એકસઠ
(૧૬૧)મી બોર્ડ બેઠકની કાર્યવાહીની નોંધ.

અધ્યક્ષશ્રી, રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના પ્રમુખ સ્થાને સત્તામંડળની ૧૬૧મી બોર્ડ બેઠક તા.૦૫-૦૯-૨૦૨૦ને શનિવારનાં રોજ ૧૧-૦૦ કલાકે યોજાયેલ, જેમાં નીચે મુજબની વિગતે અધ્યક્ષશ્રી તથા સભ્યશ્રીઓ હાજર રહેલ.

- | | | |
|----|---|---|
| ૧. | શ્રી ઉદીત અગ્રવાલ
(આઇ.એ.એસ.) | અધ્યક્ષશ્રી, રૂડા અને
મ્યુનિસીપલ કમીશ્નરશ્રી,
રાજકોટ મહાનગરપાલિકા,
રાજકોટ. |
| ૨. | શ્રી એચ.સી.તન્ના
(કલેક્ટરશ્રી, રાજકોટના પ્રતિનિધિ) | મામલતદારશ્રી
કલેક્ટર કચેરી,
રાજકોટ. |
| ૩. | કુ. સ્તુતિ ચારણ
(આઇ.એ.એસ.) | પ્રાદેશિક કમિશ્નરશ્રી,
નગરપાલિકાઓ,
રાજકોટ વિભાગ. |
| ૪. | શ્રી એચ.વી.ડોરીવાલા
(મુખ્ય નગર નિયોજકશ્રી
ગાંધીનગરના પ્રતિનિધિ) | નગર નિયોજકશ્રી,
નગર આયોજન અને મુલ્યાંકન ખાતુ,
શાખા કચેરી,
રાજકોટ. |
| ૫. | શ્રી એચ.યુ.દોઢીયા | સીટી એન્જીનીયરશ્રી,
રાજકોટ મહાનગરપાલિકા,
રાજકોટ. |
| ૬. | શ્રી ઉદય કાનગડ | ચેરમેનશ્રી,
સ્ટેન્ડીંગ કમિટી,
રાજકોટ મહાનગરપાલિકા,
રાજકોટ. |
| ૭. | શ્રી ચેતન બી. ગણાત્રા | સભ્ય સચિવશ્રી અને
મુખ્ય કારોબારી અધિકારીશ્રી,
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ, |

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ
બોર્ડ બેઠક નં.-૧૬૧, તા. ૦૫-૦૯-૨૦૨૦ના રોજ ૧૧-૦૦ કલાકે

રાજકોટ

બેઠકની શરૂઆતમાં સભ્ય સચિવશ્રી અને મુખ્ય કારોબારી અધિકારીશ્રીએ આજની બેઠકમાં હાજર રહેલ તમામ સભ્યશ્રીઓને આવકારી કોરમ પૂર્ણ થતા માન. અધ્યક્ષશ્રીની અનુમતીથી એજન્ડા મુજબની કાર્યવાહી શરૂ કરવામાં આવી.

આજની બેઠકમાં નીચે જણાવ્યા મુજબના મુદ્દાઓની ચર્ચા વિચારણા કરી નિર્ણય લેવામાં આવેલ છે.